



બ્રેમ્પટન ટ્રાન્ઝિટ પ્રવાસીઓને બસોમાં, બસ સ્ટોપ્સ પર અને ટર્મિનલ્સ પર નોન-મેડિકલ માર્ક્સ પહેરવાની ભલામણ કરવામાં આવી

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (મે 22, 2020) – ઓન્ટેરિયો ગવર્નમેન્ટ અને રીજીયન ઓફ પીલ હવે ભલામણ કરે છે કે પબ્લિક ટ્રાન્ઝિટમાં પ્રવાસ કરતા લોકોએ ઉતારુઓ વચ્ચે શારીરિક અંતર જાળવવું પડકારભર્યું હોય ત્યાં નોન-મેડિકલ માર્ક્સ પહેરવા જોઈએ. આ શહેર માટે રહેવાસીઓ અને કર્મચારીઓનું આરોગ્ય અને સુરક્ષા ખૂબ મહત્વની છે, અને COVID-19 ને લીધે ઉતારુઓને બ્રેમ્પટન ટ્રાન્ઝિટની બસોમાં અને બસ સ્ટોપ્સ અને ટર્મિનલ્સ પર નોન-મેડિકલ માર્ક્સ પહેરવાની સખત ભલામણ કરવામાં આવે છે.

ઉતારુઓને ટર્મિનલ્સ પર અને બસ સ્ટોપ્સ પર અને બસમાં ચઢતી વખતે કે બસમાંથી ઊતરતી વખતે અન્ય લોકોથી છ ફૂટ (2 મીટર) દૂર રહીને શારીરિક અંતર જાળવવાનું યાદ અપાવવામાં આવે છે.

નોન-મેડિકલ માર્ક્સના સંદર્ભમાં માહિતી માટે, રીજીયન ઓફ પીલની [વેબસાઈટ](#) અને ગવર્નમેન્ટ ઓફ ઓન્ટેરિયોની [વેબસાઈટ](#) જુઓ.

COVID-19 સુરક્ષા ઉપાયો

વધારે સારી સફાઈ અને સ્વચ્છતા (સેનિટાઈઝિંગ) સમયપત્રક અમલમાં રહે છે. બ્રેમ્પટન ટ્રાન્ઝિટનું લક્ષ્ય તમામ સખત સપાટીઓ, ઓપરેટર કમ્પાર્ટમેન્ટ્સ અને બેઠકોને દર 48 કલાકે ચેપરહિત કરવાનું છે. મોટા ભાગની બસોને હાલમાં દર 24 કલાકે સેનિટાઈઝ કરવામાં આવે છે. સખત સપાટીઓ ધરાવતી સગવડો અને ટર્મિનલ્સને રોજંદા ધોરણે સાફ અને સેનિટાઈઝ કરવામાં આવે છે. ઉતારુઓને પ્રવાસ કરતી વખતે પોતાના અંગત ડિસઈન્ફેક્ટન્ટ (ચેપનાશક પદાર્થ), જેમ કે હેન્ડ સેનેટાઈઝર કે વાઈપ્સ સાથે રાખવા, અને પોતાના હાથ અવારનવાર ધોવા પ્રોત્સાહિત કરવામાં આવે છે.

સીટી ઓફ બ્રેમ્પટન જોખમો પર દેખરેખ ચાલુ રાખવા પીલ પબ્લિક હેલ્થ અને બ્રેમ્પટન ઈમરજન્સી મેનેજમેન્ટ ઓફિસમાં પોતાના ભાગીદારો સાથે ઘનિષ્ઠપણે કામ કરી રહ્યું છે. અદ્યતન માહિતી નિયમિત મેળવવા વેબસાઈટ www.brampton.ca/covid19 અને www.bramptontransit.com જોતા રહો અથવા સર્વિસ અપડેટ્સ માટે Twitter પર @bramptontransit ને અનુસરો. કોઈ પ્રશ્નો સીધા બ્રેમ્પટન ટ્રાન્ઝિટના સંપર્ક કેન્દ્રને 905.874.2999 નંબર પર પૂછી શકાય છે.

અવતરણો (ક્વોટ્સ)

“આપણાં શહેરમાં આપણાં સમુદાયનું આરોગ્ય અને સુરક્ષા અમારા માટે ખૂબ મહત્વનું છે. હું બ્રેમ્પટન ટ્રાન્ઝિટના તમામ ઉતારુઓને ઓન્ટેરિયો ગવર્નમેન્ટ અને રીજીયન ઓફ પીલની ભલામણ અનુસરવા અને બસોમાં અને બસ સ્ટોપ્સ અને ટર્મિનલ્સ પર નોન-મેડિકલ માર્ક્સ પહેરવા વિનંતી કરું છું. સાથે મળીને, આપણે COVID-19 નાં ફેલાવાનો સામનો કરવાનું ચાલુ રાખી શકીએ છીએ.”

- પેટ્રિક બ્રાઉન (Patrick Brown), મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

“સીટી ઓફ બ્રેમ્પટન અમારા ટ્રાન્ઝિટ ઓપરેટરો માટે સુરક્ષિત કાર્યસ્થળ અને બ્રેમ્પટન ટ્રાન્ઝિટમાં ઉતારુઓ માટે સુરક્ષિત પરિવહન તકો પૂરી પાડવા સમર્પિત છે. ઉતારુઓને ઓન્ટેરિયો ગવર્નમેન્ટ અને રીજીયન ઓફ પીલ પબ્લિક હેલ્થની સલાહ અનુસરવા વિનંતી કરવામાં આવે છે જેથી આપણાં સમુદાયનું આરોગ્ય અને સુરક્ષાની ખાતરી કરાવી શકાય.”

- ડેવિડ બાર્રિક (David Barrick), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સીટી ઓફ બ્રેમ્પટન

-30-

मिडिया संपर्क :

मोनिका दुग्गल (Monika Duggal)

कोऑर्डिनेटर, मिडिया ऐन्ड कम्युनिटी एंगेजमेन्ट

व्यूडाल्मक संवाड

सीटी. ओड् ब्रॅम्पटन

905-874-3426 | Monika.Duggal@brampton.ca